

‘નિયાંપો’

શ્રી કચ્છી મિત્ર મંડળ
હૈદરાબાદનું મુખપત્ર

વર્ષ : ૨૦ અંક : ૨૫૮

પ્રમુખ
સુશીલ ધીરજલાલ કાપડિયા

મો. ૯૩૯૩૩ ૧૯૩૩૩

માનદ્ મંત્રી

પ્રેમચંદ કેશવજી છોડા

મો. ૯૩૪૬૦ ૫૪૬૬૦

સંપાદિકા

દર્શના દિનેશ દેહિયા

ફોન. ૬૬૪૬ ૩૬૯૫,

મો. ૮૧૦૬૪ ૦૭૧૯૧

સહ-સંપાદક

રમેશ મણીલાલ શાહ

ફોન. ૨૪૭૫ ૧૮૭૫,

મો. ૯૪૪૦૯ ૯૬૬૫૨

કાર્યાલય

શ્રી કચ્છી મિત્ર મંડળ

શ્રી કચ્છી ભવન, ૩-૫-૧૪૨,

ઈડનબાગ, રામકોટ,

હૈદરાબાદ ૫૦૦ ૦૦૧.

ફોન: ૨૪૭૫૨૩૮૩, ૬૫૯૪૨૩૮૩

email : hydmmm@gmail.com

મુદ્રક : ચંદ્રપ્રભા ગ્રાફિક્સ

૩૭, સૈયલ પ્લાઝા,

સુલતાન બજાર, હૈદરાબાદ-૯૫

ફોન ૦૪૦-૬૬ ૭૮૦ ૭૮૦

email : chandraprabhagraphics@gmail.com

કિંમત - રૂ. ૧/-

‘નિયાંપો’ માં પ્રગટ થતા કોઈ પણ લેખ, માહિતી, કે જાહેરાત માટે મંડળ કે સંપાદકોની કોઈ જવાબદારી રહેશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.



પ્રમુખશ્રીનો સંદેશ સુશીલ ધીરજલાલ કાપડિયા

Jay Jinendra...

At the moment the only thing that is capturing every important place in the news items are USA President, Donald Trump's executive orders and the most important one that has affected the entire world is HI Visas or work Visas.

I would like to point out at this juncture is that there is more development in India and a better future in India than USA.

Lots of Youngsters want to study in USA and not come back. They want to settle in USA.

After a lot of discussions with my friends staying in USA. I have come to realise that the future in USA is not as bright as it is in India.

Every place has its advantages and disadvantages and INDIA is the land of Golden opportunities at the moment.

We are growing in leaps and bounds and lets take advantage of this situation.



હરિયાલી લાવો...

હવે આપ વેબ સાઈટ ઉપર ‘નિયાંપો’ વાંચી શકો છો
www.shrikutchimitramandal.org



માનદ્ મંત્રીશ્રીનો અહેવાલ

પ્રેમચંદ્ર કેશવજી છેડા

- તા. ૩૦-૧-૨૦૧૭ નાં ભવનમાં કારોબારી સભા રાખવામાં આવી હતી.
- તા. ૧૪-૧-૨૦૧૭ નાં શાંતિવન સમિતિ તરફથી કચ્છી ભવનમાં તંબોલા નું કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું, કાર્યક્રમમાં સારી સખ્યામાં સભ્યોએ ભાગ લીધો હતો.
- તા. ૨૬-૧-૨૦૧૭ નાં શાંતિ પ્રાયમરી સ્કુલમાં ગણતંત્ર દિનના ઉપલક્ષમાં ધ્વજ વંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, તે પ્રસંગે, પ્રમુખશ્રી, સહમંત્રી, સ્કુલનાં સંચાલકશ્રી તથા કારોબારી સભ્યો હાજર રહ્યાં હતાં.
- તા. ૨૬-૧-૨૦૧૭ નાં માનવમિત્ર સમિતિ દ્વારા શકિના ફાઉન્ડેશન સંચાલિત હેન્ડીકેપ બાળકોની સાથે ધ્વજ વંદનનું કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાળકો માટે વિવિધ હરીફાઈઓ રાખી બાળકોને પ્રોત્સાહીત કર્યા અને ગીફ્ટ તથા મોમેન્ટો આપવામાં આવ્યા હતા, કાર્યક્રમમાં સમિતિના સંચાલક તથા ટ્રસ્ટી શ્રી હરીલાલભાઈ સાવલા તથા એમના સાથી કાર્યકર્તાઓ, તથા સમાજના સભ્યો હાજર રહ્યાં હતાં.



સંપાદકીય

સંપાદિકા : દર્શના દિનેશ દેદિયા
સહ સંપાદક : રમેશ મણીલાલ શાહ

દરેક વ્યક્તિ પોતે વધારે ને વધારે સફળ બનવાનો પ્રયત્ન કરે છે. પછીતે વ્યક્તિગત રીતે હોય કે વ્યવસાયક રીતે. પરંતુ દરેક ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે ગુરૂ કે મંત્ર નથી હોતા. તો એ માટે શું કરવું ?

આ માટે જરૂર છે સફળ માણસોની હેબીટ્સ, એમની ડીસીપ્લીન અને એમની કાર્યકુશળતા જોવાની, એમણે કેવી રીતે સફળતા પ્રાપ્ત કરી તે જાણવાની. સફળ માણસોની કાર્યપદ્ધતિ જ એમની સિદ્ધીનું કારણ હોય છે. દરેક વ્યક્તિની કાર્યપદ્ધતિ અલગ અલગ હોય છે આવી વ્યક્તિઓને જો વિનયથી ને વિનમ્રતાથી એમની સફળતા વિશે પુછવામાં આવે તો જરૂર એમના જ્ઞાનનો લાભ મેળવી શકાય. અવાર નવાર અવનવી વ્યક્તિઓને જો આવી રીતે મળાય અને વિચાર વિમર્ષ થાયતો સફળતાના સપના સાચા સાબિત થાય. આને "Connect the Dots" Process કહેવાય.

વિવિધ વ્યક્તિઓના વિવિધ વિચાર થકી આપણા સપના સાકાર કરવાની આ Positive પદ્ધતિ છે.

એકજ વ્યક્તિને "Role Model" બનાવીને જીવવા કરતા આ "Connect the Dots" પદ્ધતિ વધારે સિદ્ધિ અપાવશે.

Advertising - Designing - Printing - Flex Banners, Computerised Horoscope, Kundli Match Making, in Hindi, Gujrati, Telugu & English Language., Advertisements in Leading News papers, For Bulk SMS, Multi Colour Stickers for Marriage LOGO Designing, Broucher & Souvenir Printing
CHANDRAPRABHA GRAPHICS
Paras Ramesh Jagirdar 66680780, 40047999



(સ.મ.)



માનવ મિત્ર સમિતિ

સંચાલક :
હરિલાલ ભીમશી સાવલા

પ્રતિવર્ષની જેમ તા. ૨૬ મી ના ગણતંત્ર દિવસે અમારી સમિતિ ધ્વજવંદનનો કાર્યક્રમ કોઈને કોઈ આશ્રમમાં યોજવું હતું તેવીજ રીતે આ વર્ષે પણ ધ્વજવંદનનો કાર્યક્રમ “શક્તિના ફાઉન્ડેશન” હયાતનગરમાં હૈદરાબાદના મદંબુદ્ધિ તથા હેન્ડીકેપ બાળકો (કુલ સંખ્યા ૭૫) સાથે સવારના ૧૦.૩૦ કલાકે આપણા સમાજના સભ્યો તેમજ મૂઠીભર અનાજ યોજનાના વોલીન્ટરો સંગાથે સંચાલક શ્રી હરિલાલ સાવલા, શ્રી હિતેનભાઈ સંઘોઈ સાથે કરેલ. રવિવાર, તા. ૨૨-૧-૨૦૧૭ના દિવસે મુઠીભર અનાજ યોજનાના વોલીન્ટરો શક્તિના ફાઉન્ડેશનના બાળકો માટે ડ્રોઇંગ, લીબુ સ્પુન, ફોગ જમ્પીંગ, દોડવાની હરીફાઈ, કેરમ બોર્ડની હરીફાઈઓ રાખેલ. આ હરિફાઈમાં સારો દેખાવ કરનાર બાળકોને પ્રાઈઝ આપવામાં આવેલ. ધ્વજવંદનના કાર્યક્રમ બાદ આશ્રમના બાળકોનો ફેન્સીડ્રેસનો કાર્યક્રમ હતો, જેમાં જજસ તરીકે શ્રીમતી ભારતીબેન નાગડા અને શ્રીમતી જયશ્રી મામણીઆએ સેવા આપેલ. ત્યારબાદ આશ્રમના બાળકોએ બે ડાન્સ તેમજ મૂઠીભર અનાજ યોજનાના વોલીન્ટરોએ એક ડાન્સ અને એક નાનકડી “સ્વચ્છ અભિયાન” ઉપર નાટીકા શ્રી હિતેનભાઈ સંઘોઈ અને શ્રી દીપેશ બોરીયાએ ભજવેલ હતું. શ્રી કરણ ગાલા ડાન્સ કરેલ ત્યારબાદ પ્રાઈઝનું વિતરણ થયેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શક્તિના ફાઉન્ડેશનના સંચાલક તથા આપણા સભ્યો દાતાઓને - આભાર વ્યક્ત કરી ભોજનને ન્યાય આપેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે માનવ મિત્ર સમિતિ, મૂઠીભર અનાજ યોજનાના વોલિન્ટરોના ખાસ આભાર.

સખીદાતાઓના નામ / આભાર

૧. શ્રી લક્ષ્મણભાઈ (તારા કેટરર્સ)નો સ્વાદીષ્ટ ભોજનની વ્યવસ્થા માટે.
 ૨. છેડા, ભેદા તથા કુરીયા, ભાવીક મંડળ તરફથી રમતગમતના સાધનો આશ્રમ માટે આપવામાં આવેલ.
 ૩. શ્રી લક્ષ્મીચંદ ખીમજી છેડા જેમણે રૂ. ૧૨૦૦૦/- મુલ્યના રમતગમતના સાધનો આશ્રમને આપ્યા તેમનો.
 ૪. ચિ. રીયાન તેજસ ગાલા જેમણે બસની વ્યવસ્થા કારીગુડાથી હયાતનગર આશ્રમ સુધી કરવા માટે.
 ૫. માયરા કૂનાલ હરીયા જેમણે મેજીકશોની વ્યવસ્થા કરી તે માટે
 ૬. ચિ. વૃશંક ઉમેશ વોરા, જેમણે આશ્રમના કર્મચારી તથા સ્ટાફને મોમેન્ટો ઉપલબ્ધ કરવા માટે.
 ૭. શ્રી હરેશ દેદીયા જેમણે આશ્રમના સર્વે બાળકોને પ્રાઈઝ આપવા માટે.
 ૮. શ્રી હરિલાલ સાવલા, શ્રી જીતેન્દ્ર ગાલા, શ્રી નિતીન ટી. ગાલાએ આશ્રમ મધ્યે આ કાર્યક્રમ માટે ટેન્ટ, ખુરશીઓ તેમજ મ્યુજીક સીસ્ટમની વ્યવસ્થામાં સહકાર આપ્યો બદલ.
 ૯. તા. ૨૨-૧-૨૦૧૭ના દિવસે આશ્રમ મધ્યે મધ્યાન ભોજનની વ્યવસ્થા કરવા બદલ શ્રી જીનલ પંકજ દેદીયાનો.
 ૧૦. શ્રી પંકજ હીરજી સાવલા જેમણે તેમના પૂ. પિતાશ્રી હીરજી સાવલાની પુણ્ય તિથી નિમિત્તે ૨૫ કિલો ચોખા, ૨૫ કિલો દાળ આપવા બદલ.
 ૧૧. વૃષ્ટિ કમલ હરિયા કેક માટે
- આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉપરોક્ત સર્વે દાતાઓનો ખાસ આભાર.

આવેલ દાનની વિગત

દાતાઓના નામ	આશ્રમ રૂ.	ગૌશાલા રૂ. એક ઓટો	ડાયાલીસીસ (એક ના રૂ.૫૦૦લેખે)	પીપલ્સ ફોર એનીમલ	હોસ્પિટલ	જીવદયા (કમ્પુતરને ચણા)
શ્રી મણિલાલ રામજી ધરોડે પુત્રની પુણ્યતિથી નિમિત્તે	૨૫૦	-	-	૨૫૦	-	-
શ્રીમતી લેખાબેન સુધિર ગાલા	-	-	૧	-	-	-
શ્રીમતી રંજનબેન શાહ	-	-	૨	-	-	-
શ્રીમતી દેવકાબેન ખીમજી ખેતશી, જયંતીભાઈની પુણ્યતિથી નિમિત્તે	-	૨૦૦૦	-	-	-	-
વોરા ભાવિક મંડળ	-	૨૫૦૦	-	-	-	-
શ્રીમતી જયેશબેન નરશી ગોસર	-	૧૧૦૦	-	-	-	-
શ્રીમતી ચંદ્રાબેન હરિલાલ સાવલાના સ્મરણાર્થે	-	-	૨	૫૦૦	૫૦૦	-

મહિલા સમિતિ

સંચાલિકા : દર્શના સાવલા
ફોન. ૯૦૩૨૭ ૬૭૧૧૧

શ્રી કચ્છી મિત્ર મંડળ મહિલા સમિતી દ્વારા આયોજીત

જુલ જા 'સિમ-સિમ'

તા. ૮-૩-૨૦૧૭, બુધવાર સાંજના ૫.૦૦ વાગે કચ્છી ભવનમાં આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે. 'મહિલા દિવસ'ની ઊજવણી નિમિત્તે સાથે મળીને કરીએ ધમાલ.

"The best Woman in Blue" ને ખાસ પુરસ્કાર. અભાહારની વ્યવસ્થા રાખેલ છે. ચૌવિહાર માટે પહેલેથી જ નામ લખાવી દેવા વિનંતી જેથી વ્યવસ્થા કરી શકાય.

સંપર્ક : નિશા - ૯૫૩૩૩ ૩૦૯૨૧

નોંધ : ૫.૩૦ વાગ્યા પછી આવનારને રૂ. ૨૦/- આપીને ફુડ કુપન લેવા અને તેઓ ગેમમાં ભાગ નહીં લઈ શકે.

New Address DHAWAL BHARAT MARU

Sm Sai Hills, Survey No. 262, Flat No. 508, East Block,
Manikonda Jagir Village, Rajendra Nagar Mandal,
Hyderabad - 500 089. Ph : 96660 66060.

New Telephone No.

Dinesh Kalyanji Gosar

Resi. : 040-4850 1427

Keshavji Premji Chheda

Resi. : 040-4850 8098

શાંતિવન સમિતિ

સંચાલક: હંસકુમાર રાયચંદ સાંચલા
ફોન. ૯૨૪૬૫ ૩૨૫૪૫

શનિવાર તા. ૧૪ જાન્યુઆરી ૨૦૧૭ના સાંજના ૬.૦૦ કલાક થી સંકાંતીના માહોલમાં D.A.R.R. તંબોલાના કાર્યક્રમનું ૧૫૦ જણની હાજરીમાં સફળ આયોજન થયેલ. રજીસ્ટ્રેશન કાઉન્ટરથી તંબોલોની ટિકિટો આપવામાં આવેલ તથા તીળગુળ થી સ્વાગત કરવામાં આવેલ સર્વ પ્રથમ નિયમોની બધાને જાણ કરવામાં આવેલ તથા કાર્યક્રમમાં પધારેલ મુખ્ય સ્પોન્સર માતુશ્રી મણીબેન રતનશી ગોગરીનું તાળીઓના ગડગડાટથી સ્વાગત કરવામાં આવેલ. કારોબારી સમિતિના સહમંત્રી શ્રી દિનેશ ગોસર, શીક્ષણ સમિતિના સંચાલક શ્રીમતી વાસંતીબેન, ટ્રસ્ટીશ્રી ચીમનલાલ ગાલા, શ્રી અમૃતલાલ નિસર આદી મહાનુભવોની હાજરીની નોંદ લેવામાં આવેલ તથા તેમનો પણ સ્વાગત કરવામાં આવેલ. શ્રી હિતેનભાઈ સંઘોઈના creative આયોજનનો સંચાલન શ્રી હર્ષદભાઈ ધરોડ, શ્રી મહેન્દ્ર વોરા, શ્રીમતી દર્શનાબેન દેટીયા, શ્રીમતી ગીતા શાહ, શ્રી દિપકભાઈ માલદેએ બહુ ખુબીથી કરેલ કાર્યક્રમના વેઆરીમાં શ્રી ધીરજભાઈ ધુલ્લા તથા શ્રીમતી નીતાબેન માલદેનું સાથ મળેલ ત્રણ કલાક સુધી ખુરસી માં બધાને જકડી રાખવા માટે સંચાલક ટીમને પ્રશંસા મળેલ. સામાન્ય જ્ઞાનની પ્રશ્નોત્તરી કરવામાં આવેલ, સાચો જવાબ આપનારને પ્રોસ્તાહનાત્મક ઈનામો આપવામાં આવેલ. તંબોલોના બીજો હાઉસકુલના શ્રી અમૃતલાલ નીસર તથા ત્રીજો હાઉસકુલના શ્રી હર્ષદભાઈ ધરોડ સ્પોન્સર બન્યા. રજીસ્ટ્રેશન કાઉન્ટર શ્રીમતી કાન્તાબેન દંડ, શ્રીમતી રશ્મીબેન લોડાયા તથા શ્રી નીતીન સતરાએ સંભાળેલ વિડીયો ક્લીપીંગ શ્રી દિપક લોળગે કરી આપેલ તથા વિડીયો કુમારી નેહા સંઘોઈ તથા નિશીત માલદે સુંદર રીતે કરી આપેલ. ઓડીયોની જવાબદારી શ્રી પ્રવિણ ગાલાએ સંભાળેલ તથા ક્લીપ ડિસપેનું શ્રીમતી દિપ્તી તથા અતુલ સાયલાએ સંભાળેલ. આ સર્વે સહાયભુત થયેલ કાર્યકર્તાઓનું સમિતિ આભાર માને છે. અંચમાં શ્રી રમેશ ઈડલીવાલાના સ્વાદીસ્ટ અલ્પહારને માન આપી સૌ છુટા પડયા, જતા જતા કાર્યક્રમ માટે ખુશી વ્યક્ત કરતા અગામી કાર્યક્રમ માટે ભલામણ કરતા ગયા.

સોમવાર તા. ૧૩-૩-૨૦૧૭ના ધુળેટીના દિવસે સાંજના ઠીક ૫.૦૦ વાગ્યાથી એક અનોખી અંતાક્ષરીનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. પ્રવેશ ફી રૂ. ૨૦/- માત્ર, સાંજના ૭.૦૦ વાગ્યા સુધીજ ફુડ કુપન આપવામાં આવશે. **કાર્યક્રમનાં સ્પોન્સર M/s. શાંતિ સેલેક્શન છે.**



વૈદિક, જૈન પદ્ધતિથી લગ્ન વિધી, વાસ્તુ શાન્તિ, પિતૃદોષ, કાળસર્પ નિવારણ, સત્યનારાયણની પૂજા, રાંદલ (રણાદેવઈ) તેડવા, નડતા દરેક ગ્રહોની શાન્તિ, શ્રાધ્ધ, નાગ-નારાયણ બલી, દસમું, અગ્યારમું, બારમું, તેરમું વગેરે જન્મ કુંડી અને ફળાદેશ, આર્થિક, માનસિક, શારીરિક ચિંતાના પ્રશ્નો માટે સંપર્ક કરો

વિજયકુમાર શુક્લા ફોન : ૨૪૪૧ ૪૯૦૩, ૯૩૯૧૨ ૩૩૪૦૮

ફોન કરો ત્યારે આપનો ફોન નંબર તેમજ સરનામું જરૂર આપશો

(જા.ખ.)

॥ શ્રી સીરીયલ માતાજીને નમઃ ॥

સાવલા નુખના ભાવિકોની પહેડી

ભાવિકો અને નિયાણી બહેનો જોગ

સવિનય જણાવવાનું કે સાવલા નુખના શ્રી સીરીયલ માતાજીને નમતા ભાવિકોની સમૂહ પહેડી તા. ૨૬-૦૨-૨૦૧૭ રવિવારના સવારના ૧૦.૦૦ કલાકે શ્રી કચ્છી ભવનમાં રાખવામાં આવેલ છે. આ પ્રસંગે નુખના સર્વ ભાવિકો સપરિવાર તથા નિયાણી બહેનોને સજોડે પધારવાનું ભાવભીનું આમંત્રણ છે.

કાર્યક્રમ

માતાજીનું સામૈયુ તથા સ્થાપના	૧૦.૩૦ કલાકે
માતાજીના ભજનગીતની રમઝટ તથા રાસ ગરબા	૧૧.૦૦ કલાકે
માતાજીને પ્રસાદ-થાળ જીવારવાનું.....	૧૧.૩૦ કલાકે
માતાજીની આરતી	૧૨.૦૦ કલાકે
અન્ય માહીતી.....	૧૨.૩૦ કલાકે
માતાજીની પ્રસાદી (પ્રીતી ભોજન)	૦૧.૦૦ કલાકે
પ્રસાદીના લાભાર્થી : સામૂહિક પ્રસાદી સાવલા નુખના ભાવિકો તરફથી લી. સાવલા ભાવિક સંઘ-હૈદરાબાદના જયજીનેન્દ્ર	

સંપર્ક

પંકજ વલ્લભજી સાવલા	વલ્લભજી મેઘજી સાવલા	પંકજ હીરજી સાવલા
૯૩૯૪૫ ૫૩૧૫૪	૬૬૬૨૧૦૯૨	૯૮૪૯૭ ૪૭૬૨૫

નોંધ : શ્રીફળ પ્રથા બંધ છે.

ભાવિકોને ખાસ વિનંતી કાળા વસ્ત્ર પહેરીને આવવું નહિ.

(જા.ખ.)

Congratulations... અભિનંદન

શંખેશ્વર પાર્શ્વનાથ દાદાની મહેર,
માતા સરસ્વતિ અને વિશલ માતાની
અસીમ કૃપાથી અમારો લાડકો



ઝુબીન ગાલા M.B.A. (Finance, CGPA : 7.50)

(સુપુત્ર : શ્રીમતિ વીણા વિલાસ તલકશી ગાલા)

ગામ ચિયાસર, હાલે હૈદરાબાદ

ને મુંબઈ K.V.O. સમાજ દ્વારા સન્માનિત કરવામાં આવેલ.
ભવિષ્યમાં સફળતાના શીખરો સર કરે એવા અંતરના આશીર્વાદ.

ચિ. વિલાસ તલકશી નાનજી ગાલા

ફોન. ૯૩૯૬૨૦૦૦૯૭

Email : zubingala4@gmail.com

(જા.ખ.)

विविधा

नुमाइश

पापा पापा चलो देखने नुमाइश,
मम्मी को भी साथ ले चलेंगे
है वहाँ का जग न्यारा,
मुझे लगता बहुत प्यारा,
सारी दुकाने है सजी सजायी
भारत के हर शहर की चीज यहाँ मिलती,
किसी मे कपडा तो किसी मे जूते
किसी मे खिलौने तो किसी मे चीजे निराली
कही मसालेवाले पोपकोर्न तो कहीं भजीया गरम,
कहीं है चाट मसालेदार तो कहीं है बुढीया के बाल,
कहीं है बडा झुला तो कहीं है मेरी - गो - राउन्ड
छुक-छुक करती ट्रेन नुमाइश का लगाती राउन्ड
मम्मी तुम शांपिंग में मत खो जाना
छोटा बच्चा है साथ तुम्हारे भूल न जाना
ट्रेन मे बैठेंगे व झुले पर झुलेंगे
थोडे बहुत खिलौने खरीदेंगे व चाट पकौडी खायेंगे
जब मैं थक जाऊँगा तो वापस घर आयेंगे
पापा-पापा चलो देखने नुमाइश...
मम्मी को भी साथ ले चलेंगे...

- चंदन हरीश हरीया

REVISED ADVERTISEMENT RATES

COLOUR

* 1	Last Cover Page Outside	Rs.	3200
* 2	Second Page (Inside)	Rs.	2800
* 3	Last Page (Inside)	Rs.	2800
4	Pin Page	Rs.	2400

BLACK & WHITE

* 5	Full Page	Rs.	800
* 6	Half Page	Rs.	500
7	Quarter Page	Rs.	200
8	Strip	Rs.	100

Note : If any person gives 12 months advertisements in advance, only 10 months payments will be collected. This concession is allowed in item No.1, 2,3,5 & 6 only marked (*).

जो चाहा कभी पाया नहीं

जो चाहा कभी पाया नहीं,
जो पाया कभी सोचा नहीं,
जो सोचा कभी मिला नहीं,
जो मिला रास आया नहीं,
जो खोया वो याद आता है, पर
जो पाया - संभाला जाता नहीं, क्यों
अजीब सी पहेली है जिन्दगी
जिसको कोई सुलझा पाता नहीं,
जीवन में कभी समझौता करना पड़े
तो कोई बड़ी बात नहीं है, क्योंकि,
झुकता वही है जिसमें जान होती है,
अकड़ तो मुरदे की पहचान होती है ।
जिन्दगी जीने के दो तरीके होते है ।
पहला: जो पसंद है उसे हासिल करना सीख लो ।
दूसरा: जो हासिल है उसे पसंद करना सीख लो ।
जिंदगी जीना आसान नहीं होता,
बिना संघर्ष कोई महान नहीं होता ।
जिंदगी बहुत कुछ सिखाती है
कभी हंसती है तो कभी रुलाती है,
पर जो हर हाल में खुश रहते हैं,
जिंदगी उनके आगे सर झुकाती है ।
चेहरे की हंसी से हर गम चुराओ,
बहुत कुछ बोलो पर कुछ ना छुपाओ,
खुद ना रुठो कभी पर सबको मनाओ,
राज है ये जिंदगी का बस जीते चले जाओ ।
'गुजरी हुई जिंदगी को कभी याद न कर,
तकदीर मे जो लिखा है उसकी फर्याद न कर...
जो होगा वो होकर रहेगा,
तु कलकी फिकर में अपनी आज की हसी बर्बाद न
कर...
हंस मरते हुये भी गाता है और
मोर नाचते हुये भी रोता है...
-संकलन : पंकज वल्लभजी सावला



માનવ કલ્યાણ સેવા સમિતિ

ચેરિટેબલ ક્લીનિક

અરિહંત સુવલ એપાર્ટમેન્ટ, બેંક ઓફ ઈન્ડિયા પાછળ, જૈન મંદિર પાસે,
કાચીગુડા સ્ટેશન રોડ, હૈદરાબાદ - ૫૦૦ ૦૨૭. ફોન : ૦૪૦-૨૭૫૫ ૭૭૧૧

માનવ કલ્યાણ સેવા સમિતિ સંચાલિત ચેરીટેબલ ક્લીનિક-કાચીગુડામાં
નીચે મુજબ ડોક્ટરી સેવાઓ ઉપલબ્ધ છે. લાભ લેવા વિનંતિ.

એલોપેથી ક્લીનિક

ડૉ. કે. દેવરાજ

MBBS, MIPHA, MICA, DTCD (OSM)

Pulmonologist & General Physician - Specialist in T.B., Asthama & Allergy
દરરોજ : સાંજે ૪ થી ૬, રવિવાર બંધ • કન્સલ્ટેશન ફી રૂ. ૧૦ (બે દિવસની દવા સાથે)

હોમિઓપથી ક્લીનિક

ડૉ. સી. રોશના

BHMS (Pune), DNHE

Consultant Homoeopath

દરરોજ : સવારના ૧૧.૩૦ થી ૧.૩૦, રવિવાર બંધ • કન્સલ્ટેશન ફી રૂ. ૧૦ (બે દિવસની દવા સાથે)

કાર્ડિઓલોજી ક્લીનિક

ડૉ. પંકજ જરીવાલા

M.D., DNB, DNB (Cardiology), MNAMS, FICPS

Consultant International Cardiologist Trans Radial Interventionist - Heart Failure Specialist

દર શુક્રવારે : રાત્રે ૮ થી ૯ (અગાઉથી એપોઈન્ટમેન્ટ લેવી જરૂરી)

કન્સલ્ટેશન ફી રૂ. ૧૦૦ પ્રતિ વિઝિટ (નોન રિફન્ડબલ)

ગાયનેકોલોજી ક્લીનિક

ડૉ. અનિશા ગાલા

DGO, DNB (Reg no. 50494)

Fellowship in Maternal Medicine, Consultant Obstetrician, Gynecologist

દર મહિનાના બીજા અને ચોથા ગુરૂવારે : બપોરના ૩ થી ૪

(અગાઉથી એપોઈન્ટમેન્ટ લેવી જરૂરી) કન્સલ્ટેશન ફી રૂ. ૫૦ પ્રતિ વિઝિટ (નોન રિફન્ડબલ)

(બા.ખ.)

એકવાર વિચારધારા બદલી જોઈએ...

— દિનેશ ગોસર

આજે સમાજનો સુવર્ણકાળ ચાલી રહેલ છે. બધેજ સારા વાના છે. સેંકડો સંસ્થાઓ સમાજની દરેક સમસ્યાનું સમાધાન કરવા ઉત્સુક છે. પ્રયત્નશીલ છે. પરંતુ...

- આજે આપણામાંના ઘણાં મધ્યમવર્ગીય પરિવારો જેને રહેવા માટે પોતાનું ઘર નથી એમની વાત નથી કરવી.
- આજે સમાજમાં પ્રવર્તમાન સગપણની સમસ્યા અને ત્યારબાદ ફૂલી ફાલી રહેલ છૂટાછેડાની વાત નથી કરવી.
- આજે વધતી જતી મોંઘવારીમાં આવક-બાવકના પાસા સરખા કરવા મથતા આમ આદમીની વાત નથી કરવી.
- આજે ગૃહઉદ્યોગ દ્વારા પરિવારની આવકમાં ઉમેરો કરવા ઈચ્છતી મહિલાઓની વાત નથી કરવી.

આજે વાત કરવી છે એવા સમાજના સભ્યોની જે આજે અચ્છે દિનમાં મહાલી રહ્યા છે. મોટા ઔદ્યોગિક ગૃહો, બિલ્ડરો, શેરબજાર અથવા અન્ય કોઈ પરંપરાગત મોટો ધંધો અથવા વ્યવસાય ધરાવનારની.

એક અવલોકન પ્રમાણે બધી રીતે સારા વાના હોવા છતાં, બધા સકારાત્મક પરિબલો આપણી સાથે હોવા છતાં.

- કોર્પોરેટ વર્લ્ડમાં ગણના થાય એવા ઔદ્યોગિક ગૃહો આપણાં સમાજમાં કેટલા ? ૧૦૦૦ કરોડથી વધુ અસ્કયામતો ધરાવતા ઔદ્યોગિક પરિવારો આપણાં સમાજમાં કેટલા ? એક, બે કે ત્રણ... બસ.... ફક્ત અસ્કયામતો જ શા માટે ?
- પોતાના ક્ષેત્રે નામ કાઢ્યું હોય એવા પ્રોફેશનલ્સ કેટલા ?
- કળા ક્ષેત્રે આપણાં સમાજ સિવાય બહાર પણ ખ્યાતિ હોય એવા કલાકારો કેટલા ?
- રમતગમતમાં રાજ્ય, રાષ્ટ્ર કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જેમનું નામ હોય એવા રમતવીરો કેટલા ?
- જેમના મંતવ્યોની મિડિયાએ નોંધ લેવી પડે એવા સામાજિક અથવા અન્ય કાર્યકરો કેટલા ?

કંઈક તો ખૂટે છે આપણામાં... શું હોઈ શકે એ આપણે જાતે મંથન કરવાની જરૂર છે. આજે ૧૦૦૦ કરોડ કે તેથી વધુ અસ્કયામતો ધરાવતા ઔદ્યોગિક ગૃહોની વાત એમની અંગત સંપત્તિ માટે નથી કરવી, એમના એશો-આરામ કે એશ્વર્ય માટે નથી કરવી.

આવા ઔદ્યોગિક ગૃહો સમાજ, રાષ્ટ્ર કે વિશ્વ માટે એસેટ છે.

તેઓ પોતાના સામર્થ્ય, વિવિધતા અને વિસ્તરીકરણ દ્વારા હજારો લોકોને રોજગાર આપી રાષ્ટ્ર ઘડતરમાં ફાળો આપે છે. ટ્રસ્ટીશીપના સિધ્ધાંતને અનુસરી પોતાની મિલકતોનો એક હિસ્સો સમાજ કે રાષ્ટ્રના ઉત્થાન માટે ફાળવી પોતાની ફરજ બજાવે છે.

અને એટલે જ એમનું ફૂલવું ફાલવું જરૂરી છે.

શું આપણે જ્ઞાતિ, પેટા જ્ઞાતિ અથવા સમાજના વાડામાં બંધાઈ એક સુરક્ષા કવચની અંદર આપણને સલામત માની રહ્યા છીએ ? આજે જમાનો નવી સોચનો છે, અલગ રીતે વિચારવાની ક્ષમતાનો છે,

ફ્રેન્ડ્સ સોશયલ ગ્રુપ

બડી ચાવડી, હૈદરાબાદ

૯૮૪૯૭ ૪૭૬૨૫, ૯૨૪૬૧ ૯૪૪૦૫, ૯૩૯૧૦ ૨૪૧૦૮

૩૫ વર્ષની યાદગાર સફર...

ફ્રેન્ડ્સ સોશયલ ગ્રુપ રજુ કરે છે ગીત અને સંગીતની કર્ણપ્રીય સંગીતમય સાંજ “દીલ ને ફીર યાદ કીયા” જે પ્રસ્તુત કરશે મુંબઈના આપણા પ્રખ્યાત કલાકાર શ્રી મણીલાલ નાનજી છેડા, હિન્દી અને ગુજરાતી ફીલ્મી ગાયકીમાં જેમનું આગવું અસ્થિત્વ છે તેઓ પ્રસ્તુત કરશે.

“મોનીશ વન મેન શો”

તારીખ : ૨૫-૨-૨૦૧૭ શનિવાર (જાહેરરજા દિવસ)

સમય : સાંજના ૬.૩૦ વાગ્યાથી

સ્થળ : શ્રી કચ્છી ભવન, રામકોટ, હૈદરાબાદ

કાર્યક્રમ દરમ્યાન સમાજના પાયાના સ્થંભ એવા અગ્રણી કાર્યકર્તાઓનું બહુમાન “Pride of Samaj” “સમાજ ગૌરવ”થી કરવામાં આવશે.

સાથે સામાજિક ક્ષેત્રે માનવ કલ્યાણ એજ જેમના જીવનનું ધ્યેય છે એમનું બહુમાન કરવામાં આવશે.

આ સામાજિક કાર્યક્રમમાં આપ સૌ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધી કરશો એવી મંગલકામના.

કાર્યક્રમ દરમ્યાન અલ્પાહારની વ્યવસ્થા છે.

(જા.પી.)

જમાનાને અનુરૂપ નવા સાહસો શરૂ કરવાનો છે.

શા માટે આપણે ફિલ્મપકાર્ટ, સ્નેપડીલ, ઓમેગોનની જેમ નવા સાહસો વિચારી ન શકીએ ? કરોડો રૂપિયા નુકશાની કરવા છતાં સફળ બિઝનેસ મોડલ એ આપણી પરંપરાગત વિચારધારાની સમજની બહાર છે. પરંતુ એ હકીકત સ્વીકારવી રહી એ માટે જરૂર છે આઉટ ઓફ બોક્ષ વિચારધારાની, એવી વ્યક્તિઓને તક આપવાની જે આવી વિચારધારા ધરાવતી હોય.

- શા માટે આપણાં યુવાનો શ્રેષ્ઠતમ શૈક્ષણિક કારકિર્દી બાદ એક સારી નોકરી મેળવી પોતાને સલામત માને છે ?
- ક્યાં છે સ્ટાર્ટ અપ ? ક્યાં છે નવી શોધ પાછળ ગાંડા બની રચ્યા રહેતા વૈજ્ઞાનિક અભિગમ વાળા યુવાનો ?
- ક્યાં છે ધૂની કલાકારો અથવા સાહિત્યકારો ?

આપણે બધામાં શું સલામતી શોધીએ છીએ ?

શું આપણે આ સલામતીની ભાવનાને કારણે રિસ્ક લેવાનું ઓછું કરી રહ્યા છીએ ?

ધર્મ, ધાર્મિક અને સામાજિક પરંપરાઓ શું આપણી વિચારધારાને કુંઠીત બનાવી રહી છે ? દરેક પ્રત્યે વાસ્તવિક અભિગમ જરૂરી છે.

અનુદાનોમાં નવી વિચારધારાની જરૂરીયાત નથી જણાતી ?

ક્યાં છે બિલ ગેટ્સ, માર્ક ઝુકરબર્ગ જેવા દાનવીરો. ક્યાં છે અઝિમ પ્રેમજી, નારાયણ મૂર્તિ જેવા દાનવીરો જેમનું દાન એક ધ્યેય સાથે હોય, ફક્ત સહાય માટે નહિં.

જરૂર છે આપણે બધાને પોતપોતાના ક્ષેત્રના સુરક્ષા કવચ તોડવાની.

જરૂર છે થોડાક ધૂની બની નવુ ગતકરું કરવાની.

જરૂર છે આવા ધૂનીઓને પ્રોત્સાહિત કરવાની.

જરૂર છે આપણાં બાળકોમાં આવી ધૂનો ભરવાની.

જરૂર છે આપણી સોચનો વ્યાપ વધારવાની.

Yogen Hindocha

Cell : 9030119411

email : yogenhindocha@gmail.com



INVEST IN MUTUAL FUNDS AND SAVE TAX U/C 80C

(જા.ખ.)

DONATE EYES - LIVE TWICE

શુદ્ધ ઘીની ઘરમાં બનાવેલ મિઠાઈ

મગદરીયા લાડું (પાંચ ધાન્યના)
 ફીણીયા લાડું
 નાયણી (રાગી) ખજુર લાડુ (સુગર ફી)
 અલશી મખાના લાડું (કેલશિયમ-વિટામીનથી ભરપુર)
 ડ્રાયફ્રુટ લાડું (ઘઉંના)
 ગોળ પાપડી
 ગોળીયા લાડુ
 અડદિયા પાક (શીયાળુ પાક)
 કોકોનેટ બીસ્કીટ
 સાંગલીના ભડંગ
 શીંગદાણાની ચટણી
 સિકંદર ના ખારી સીંગ
 સિકંદર ના ચણા
 ફાર્મા ગ્રેડ સ્પેશીયલ દવા માટેની હળદળ

Contact

PRAVIN K. CHHEDA

102, Uma Residency, Near Jineshwardam,
 Kachiguda, Hyderabad. (R) Ph : 2755 2939

PRAVIN CHHEDA - 89857 59320

PREMILA CHHEDA - 90146 66932

ઘરની બનાવેલ તલની ચિક્કી, સિંગદાણાની ચિક્કી, ફરસી પુરી,
 ચકરી, સેવ ઇત્યાદી ઓર્ડર મુજબ બનાવી આપવામાં આવશે.
 નીતા વિરા, બડીચાવડી, હૈદરાબાદ. મો. ૮૧૦૬૫૭૬૮૮૦

(અ.પી.)

કરચલી પડવાના કારણો અને ઉપાયો

સંકલન : રમેશભાઈ શાહ

તમારા મોંની ચામડી સુંવાળી અને ઈલેસ્ટીક (સ્થિતિસ્થાપક) હશે તો તમે ગુસ્સે થાઓ કે હસવા માંડો ત્યારે અને આંખો ઝીણી કરીને કાંઈ વાંચતા હો કે દૂરની વસ્તુઓ જોતા હો, ત્યારે આંખોની આજુબાજુ, કપાળ ઉપર અને ચહેરા પર જે કરચલી પડશે તે તાત્કાલિક જતી રહેશે. પણ તમે ફક્ત ચહેરાની જ નહીં પણ આખા શરીરની ચામડીની બહારથી અને અંદરથી પૂરતી સંભાળ નહીં લો તો ચામડી ઉપર કરચલી પડશે જ.

કરચલી પડવાના કારણો :

(૧) જેમ ઉંમર વધે, તેમ તમે પ્રમાણમાં ઓછા પ્રવૃત્તિશીલ રહો. કસરત કરવાની ઈચ્છા હોય પણ બીજી ઘણી બિનજરૂરી બાબતો માટે તમને સમય હોય પણ કસરત માટે સમય ના હોય અને આને કારણે હૃદયની રક્તવાહિનીઓ દ્વારા શરીરના ખૂણેખૂણે લોહી પહોંચાડવાની તાકાત ઓછી થાય. પરિણામે ચામડીને લોહી ના મળે, એટલે ચામડી સુકાતી જાય અને પાતળી થાય એટલે કરચલી પડે. (૨) ખોરાકમાં જુદા જુદા પૌષ્ટિક તત્વો તમે લેતા ના હો ત્યારે પણ કરચલી પડે. વિટામિન “સી” જે બધા જ ખટમધુરા ફળોમાંથી મળે છે તે તમે ના લેતા હો, ત્યારે શરીરના અંગોના કોષ જે વિટામિન “સી” વડે એકબીજા સાથે ચોટેલા રહે છે તે બરોબર ચોટેલા રહે નહીં. ચામડીના કોષને એકબીજા સાથે ચોટેલા રાખવાનું કામ ‘કનેક્ટીવ’ ટીસ્યુ કરે છે તે વિટામિન “સી” ની ખામીને કારણે ન થઈ શકે ત્યારે અચૂક કરચલી પડે. (૩) આપણા દેશમાં સૂર્યનો ચડકો ચામડીને ખરાબ કરવામાં મોટો ભાગ ભજવે છે કારણ સૂર્યના તડકામાં ‘અલ્ટ્રા વાયોલેટ કિરણ’ છે. જો તમે શરીરની ખુલ્લી રહેતી ચામડી ઉપર ‘સન સ્કીન લોશન’ લગાડો નહીં, અને ચામડીને કપડાથી ઢાંકેલી ના રાખો, તો તે સુકાઈ જાય અને કરચલી પડે. (૪) તમે સિગરેટ અને ગુટકા દ્વારા તમાકુ લેતા હશો તો તેનાથી રક્તવાહિનીઓ સંકોચાઈ જશે અને તમારા શરીરમાંથી વિટામિન સી ઓછું થઈ જશે અને ચામડી ઉપર કરચલી પડશે.

કરચલી ના પડે માટે શું કરશો ?

(૧) તમે સરળ નિયમિત કરી શકો તેવી કોઈપણ કસરત કરો. તમારી આજુબાજુ કોઈ ઠેકાણે લાફીંગ ક્લબ ચાલતી હોય, તો ત્યાંની કસરત શીખીને બધા સાથે અથવા ઘેર કસરત કરો. (૨) રોજ વિટામિન સી પૂરતું મળે માટે આંબળા, પપૈયુ, જામફળ, નારંગી, મોસંબી, કોબીજ, લીંબુ, કાકડી, ગાજર, બીટ વેગરનો ઉપયોગ સલાહ તરીકે કરો અથવા કાચો રસ પીઓ. (૩) સિગરેટ તમાકુ બંધ કરો. (૪) રોજ ૮ થી ૧૨ ગ્લાસ પાણી પીઓ. (૫) રોજ ૧૦૦ થી ૧૫૦ ગ્રામ મોળું ઓછી ચરબીવાળું દહીં ખાઓ. (૬) એક ભાગ ગ્લીસરીન અને ઓગણીસ ભાગ પાણીનું ‘મોશ્યુરાઈઝર’ ઘેર બનાવો અને જ્યારે બહાર જાઓ ત્યારે ચામડી ઉપર લગાડીને જાઓ. સસ્તુ પડશે. (૭) શિયાળામાં સાબુ વાપરવાનું ઓછું રાખો. (૮) ઘેરાલીલા રંગના શાકભાજી અને કઠોળ રોજ લેવાનું રાખો જેમાંથી વિટામિન બી કોમ્પ્લેક્ષ અને ઝીંક મળશે અને તેનાથી ચામડી ચુસ્ત રહેશે.

Jayendra Shah
SHAH ACCOUNTS

For your Accounts requirements of your shops
Contact Cell No. **09014302524, 09963405000**

(જા.પા.)

**Pick up
&
Drop**

CHERIAN NATIONAL

Motor Driving School (ESTD. 1962)

CONTACT : 5-9-169/4, Nampally, Chapel Road,
Hyderabad Cell : 98495 84518

(જા.પા.કે-૨૦૧૬)



દરેક પ્રકારના લાઇફ તથા જનરલ વીમા માટે સંપર્ક કરો :

લક્ષ્મીચંદ કેનિયા M.A. MDRT (USA)

ઓફિસ : ૪-૪-૨૨૮, ઈન્દ્રબાગ, સુલતાન બજાર, હૈદરાબાદ - ૫૦૦ ૦૯૫.

નિવાસ : ફ્લેટ નં. ૧૦૭-૧૦૮, શ્યામ એન્કલેવ, આર્ય સમાજ મંદિરની સામે, બડી ચાવડી,
સુલતાન બજાર, હૈદરાબાદ ૫૦૦ ૦૯૫. ફોન. (નિ.) ૬૪૫૬૨૭૫૪ (મો.) ૯૮૪૯૬ ૪૭૨૫૯



(જા.પા.)

“We have Mentors with
Mind of A Teacher &
Heart of A Parent”

Proudly announces
the commencement
of **LKG**



• Contact •

Surbhi Vora
9491123843

Mamta Vora
9391233045

Nipa Vora
9533904870

Learning n Beyond

Playgroup & Nursery

3-4-512/28, 1st Floor,
Barkatpura Colony Garden,
Barkatpura, Hyderabad - 27,
Phone 64642425,

Email: hunnybunnyhyd@gmail.com

(જા.પા.)

मोबाइल डाटा बचाने के स्मार्ट टिप्स

क्या आप हर महीने के बढ़ते मोबाइल इंटरनेट बिल से परेशान हैं ? क्या आपको भी लगता है कि बिना ज्यादा इंटरनेट का इस्तेमाल किए, आप उसकी क्रीमत चुका रहे हैं, तो आपको करने होंगे कुछ आसान से उपाय । जी हां, मोबाइल सेटिंग्स में थोड़े बदलाव करके और कुछ लेटेस्ट ऐप्स की मदद से आप अपने मोबाइल का काफ़ी डाटा बचा सकते हैं ।

कैसे खर्च होता है डाटा ?

आजकल लगभग हर दूसरे काम के लिए हम इंटरनेट का इस्तेमाल करते हैं । इंटरनेट ने हमारे काम को काफ़ी हद तक आसान बना दिया है, पर आपको पता है कि आपकी छोटी-छोटी एकटिविटीज़ पर कितना डाटा खर्च होता है, आइए डालें इस पर एक नज़र ।

- अगर आप रोज़ाना ऑनलाइन किसी न्यूज़ वेबसाइट पर 15 मिनट तक कोई न्यूज़ वीडियो देखते हैं, इसके बाद यूट्यूब पर कुछ फनी वीडियोज़ देकते हैं, किसी वेबसाइट पर आधे घंटे का कोई सीरियल देखते हैं, तो महीने में आप करीब 1.25 जीबी डाटा खर्च करते हैं ।
- 30 मिनट की ड्राइविंग के वक़्त ऑनलाइन गाने सुनने भर से आप करीब 800 एम्बी डाटा खर्च कर देते हैं ।
- कुछ लोगों को सोशल नेटवर्किंग साइट्स पर हर वक़्त फोटोज़ अपलोड करने का बहुत शौक़ होता है । सिर्फ़ फोटोज़ ही नहीं, कुछ लोग पूरा का पूरा एलबम अपलोड कर देते हैं, पर क्या आप जानते हैं कि एक दर्जन हाई रेज़ोल्यूशन फोटो अपलोड करने में करीब 400-600 एम्बी डाटा खर्च होता है । तो सोचिए अगर आप रोज़ाना ऐसा करते हैं, तो लगभग कितना डाटा खर्च होगा ?

कैसे बचाएं इंटरनेट डाटा ?

- ज़रूरी नहीं कि आपका इंटरनेट डाटा हर वक़्त ऑन रहे । अगर आप ड्राइविंग कर रहे हैं, मीटिंग में हैं, सो रहे हैं, तो उस वक़्त आप इंटरनेट का इस्तेमाल नहीं करते, उस वक़्त के लिए डाटा बंद करके न सिर्फ़ आप पैसे बचाएंगे, बल्कि मोबाइल की बैटरी भी बचाएंगे ।

- आजकल व्हाट्सऐप काफ़ी लोकप्रिय ऐप है । पर जैसा कि आप जानते हैं कि व्हाट्सऐप पर कोई भी इमेज, वीडियो और ऑडियो अपने आप डाउनलोड हो जाता है, जिसमें बेवजह बहुत-सारा डाटा खर्च हो जाता है । चैट सेटिंग्स में जाकर मीडिया ऑटो डाउनलोड में अपनी ज़रूरत के मुताबिक ऑटो डाउनलोड बंद कर दें । इससे ऑटो डाउनलोड बंद हो जाएगा और आप अपनी पसंद की इमेज या वीडियो अपनी मर्जी से डाउनलोड कर सकते हैं ।
- अक्सर हमें पता भी नहीं चलता और बैकग्राउंड में बहुत-से ऐप्स काम करते रहते हैं, जिससे आपको बिना पता चले आपका क्रीमती डाटा खर्च होता रहता है । इससे बचने के लिए सेटिंग्स में डाटा यूसेज में जाएं और..... बैकग्राउंड डाटा ऑप्शन पर टिक करें, इससे आपका काफ़ी डाटा बच जाएगा ।
- जब भी घर पर रहें, तब मोबाइल डाटा ऑफ करके घर का वाई-फाई इस्तेमाल करें, घर पर वाई-फाई लगवाना काफ़ी फ़ायदेमंद होता है, इसमें आप एक कंप्यूटर के साथ 2-3 मोबाइल भी इस्तेमाल कर सकते हैं ।
- गैरज़रूरी पुश नोटिफिकेशन बंद करें । आजकल की सोशल नेटवर्किंग साइट्स और मैसेजिंग साइट्स पर ये बहुत ज़्यादा होते हैं, जो बेवजह आकर आपका डाटा खर्च करते रहते हैं । मोबाइल के सिस्टम सेटिंग्स में जाकर पुश नोटिफिकेशन का ऑप्शन डिसेबल कर दें ।
- गाने सुनने के शौक़ीन हैं, तो ऑनलाइन सुनने की बजाय अपने पसंदीदा गानों को एक बार में ही डाउनलोड कर

પરિચયથી
પરિણય
સુધી સફરના સાથી

એટલે
ASANJOKUTCH
First Ever Kutchhi Digital E-directory

ની એક માત્ર મેટ્રીમોનીયલ વેબસાઇટ


‘અસાંજો કચ્છ’ ની ખાસ વિશેષતાઓ

- ❖ ફક્ત કચ્છી સમાજ માટેની સૌથી મોટી મેટ્રીમોનીયલ વેબસાઇટ
- ❖ ૫૦૦૦ થી પણ વધુ શિક્ષિત પાત્રોમાંથી પસંદગી
- ❖ ૧૦૦% ચકાસણી કર્યા બાદ સ્વીકારાયેલ બાયોડેટા
- ❖ ફ્રી રજીસ્ટ્રેશન
- ❖ સૌથી વધુ સક્સેસ રેટ

આજે જ રજીસ્ટર કરો...

www.matrimony.asanjokutch.com

Email : matrimony@asanjokutch.com | Phone : 022-29674007/8/09



लें, उसके बाद आप जब चाहें, तब उनका लुप्त उठा सकते हैं ।

- ऐप्स को अपडेट करने के लिए उन्हें वाई-फाई अपडेट मोड पर रखें । इसके लिए प्ले स्टोर में जाकर सेटिंग्स पर क्लिक करके ऑटो अपडेट ऑप्शन चेक करें । ऑटो अपडेट ऐप्स ओवर वाई-फाई ऑनली सिलेक्ट करें ।
- अपने डाट यूसेज़ पर नज़र रखें । इससे आपको पता चलेगा कि कौन-सा ऐप कितना डाटा इस्तेमाल कर रहा है । इसके बाद आप ऐप्स के मुताबिक लिमिट सेट कर सकते हैं । ताकि वह ऐप उससे ज़्यादा डाटा इस्तेमाल न कर पाए ।
- मोबाइल ब्राउज़र का सही चुनाव करके भी आप मोबाइल डाटा बचा सकते हैं । इसके लिए मोबाइल के लिए इस्तेमाल होनेवाले ब्राउज़र्स चुनें, जो ज़्यादा डाटा खर्च किए बिना अच्छी स्पीड से काम करते हैं । इसके लिए गूगल क्रोम, ओपेरा मिनी और टेक्स्ट ओनली ब्राउज़र्स का इस्तेमाल कर सकते हैं ।
- अगर आप बहुत ज्यादा मैप्स यानी ऑनलाइन नक्शों का इस्तेमाल करते हैं, तो ट्रैवलिंग से पहले ही वाईफाई पर गूगल मैप्स डाउनलोड कर लें । बाद में बिना ऑनलाइन गए आप ऑफलाइन भी इसका इस्तेमाल कर सकते हैं ।
- बहुत-से लोग मोबाइल में जगह बनाने के लिए कैश मेमोरी डिलीट कर देते हैं । पर अगर आप इंटरनेट का बहुत ज़्यादा इस्तेमाल करते हैं, तो ऐसा न करें, क्योंकि कैश में ऐसी कई ईमेजेस डाउनलोडेड होती हैं, जो अगली बार डाउनलोड होने से बच जाएंगी ।
- अकाउंट सिंक्रोनाइज़ सेटिंग्स का सही इस्तेमाल करें । फेसबुक और गूगल प्लस की सेटिंग्स में जाकर ऑटो सिंक्रोनाइज़ डिसेबल कर दें । इससे बेवजह ईमेजेस डाउनलोड नहीं होंगी और आपका डाटा कम खर्च होगा ।

डाटा बचाने के स्मार्ट ऐप्स

- अगर आप ऑनलाइन मैप्स वगैरह हमेशा देखते हैं, तो

Navfree (नेवफ्री) और Maps With Me Light (मैप्सविदमी लाइट) आपके लिए काफ़ी फ़ायदेमंद साबित हो सकते हैं, क्योंकि ये ऑफलाइन भी काम करते हैं ।

- Opera Maths (ओपेरा मैक्स) : अपने मोबाइल में यह ऐप इंस्टॉल करें । यह आपके वीडियोज़, इमेजेस और वेब पेजेस को कंप्रेस करके आपका डाटा सेव करने में आपकी मदद करता है, इसके अलावा अगर कोई ऐप जरूरत से ज्यादा डाटा इस्तेमाल कर रहा है, तो यह ऐप आपको इसकी जानकारी भी देता है और सबसे बड़ी बात यह है कि फ्री ऐप है ।
- (ओनावो एक्सटेंड) : फेसबुक द्वारा 2013 में लाया गया यह ऐप आपके मोबाइल डाटा को कंप्रेस करके डाटा सेव करने में आपकी मदद करता है ।
- (गूगल क्रोम) : अगर आप गूगल क्रोम ब्राउज़र का इस्तेमाल करते हैं, तो आपको अलग से डाटा कंप्रेसर डाउनलोड करने की जरूरत नहीं पड़ेगी, क्योंकि क्रोम में डाटा कंप्रेशन की सुविधा पहले से ही है ।
- (यूसी ब्राउज़र एचडी) : यह भी काफ़ी लोकप्रिय डाटा कंप्रेशन ब्राउज़र ऐप है । अपने मोबाइल में इसे डाउनलोड कर आप अपना कीमती डाटा बचा सकती हैं । इसमें ऐड ब्लॉकर्स की भी सुविधा मौजूद है । आजकल बहुत-सी मोबाइल कंपनियां इसे इनबिल्ट ऐप के तौर पर पेश करती हैं । अगर आप क्रोम इस्तेमाल नहीं कर रहे हो, तो यूसी ब्राउज़र आपके लिए एक अच्छा ऑप्शन है ।
- (व्हाट्स लोकल टुडे) : यह एक ब्राउज़र ऐप है, जो बैकग्राउंड में काम नहीं करता, जिससे आपका काफ़ी मोबाइल डाटा बच जाता है । यह एक ऑल-इन-वन ऐप है, जिसकी मदद से आप बेवजह के कई ऐप्स को अपने मोबाइल से हटा सकते हैं । इसके इस्तेमाल से मोबाइल की बैटरी भी लंबे समय तक चलती है ।

– संकलन : मेरी सहेली

Rakesh NagdaMob. : 93466 87608, 92909 52406
WHATSAPP : 8897815532**BHAKTI
ESTATES**REAL ESTATE CONSULTANT
Buying, Selling, Rental Accomodation
Commercial, Residential, Flats Offices,
Plots, Agriculture & Industrial LandOffice cum Kitchen :
No.4-6-90/19/B/1/D, Near Imory Hospital Road, Tejaswi Nagar,
Attapur, Hyderabad - 500 048.

(જા.ખ.)

Manish Nagda

Mob. : 96180 13690, 90328 82816

**Specialist in**

- JAIN FOOD • INDIAN CHAT
- BAKERY ITEMS

R.S. BANDHANI HOUSE**કચ્છની કલામય બાંધણીઓ હૈદરાબાદમાં**

કચ્છની બાંધણીઓનો ખજાનો ધોર સિલ્ક, ગંજુસિલ્ક, ઈટાલિયન ક્રેપ, જોરજટ ઈટાલિયન સામો તથા બનારસીમાં ઝીણા બંધેજ અને મીનાકારીમાં આકર્ષક અવનવી બાંધણીઓ, રીયલમાં ઘરચોળા તથા શ્રીમંત પ્રસંગ માટે ગ્રીન કલરમાં વિવિધ બાંધણીઓ, રંગબેરંગી ચણિયાચોળી અને અદ્યતન નવા પંજાબી ડ્રેસ મટેરિયલ, બેડશીટો તથા અન્ય આકર્ષક વેરાયટીઓ હોલસેલ ભાવે રીટેલમાં મળશે.

નવલબેન મહેન્દ્રકુમાર ભોગીલાલ ધરમશી૩-૨-૩૫૭/૧, ૧લે માળે, લાલબહાદુર હાઈસ્કૂલની બાજુમાં, નિમ્બોલિ અડ્ડા,
હૈદરાબાદ ૫૦૦ ૦૦૨૭. ફોન. ૨૪૬૦ ૦૮૧૦, ૨૪૬૫ ૫૬૨૨.

(જા.ખ.)

આવો, સામાજિક વ્યવહારમાં સૂચિત સુધારો લાવીયે

— ‘અજ્ઞાની’ મહેન્દ્ર વોરા

માનવ માત્ર સામાજિક પ્રાણી છે, સમુદાયમાં રહેવું સામાજિક-ધાર્મિક પ્રસંગોમાં હાજરી આપવી એ દરેક માનવીનો જાતિ સ્વભાવ છે.

જોકે હવે ધીમે ધીમે સમિકરણો બદલાતા જાય છે કુટુંબ વ્યવસ્થા તુટવાથી આવી અસર વર્તાય છે. અરસ પરસ ઘરે આવવા જવાની પ્રથા લુપ્ત થતી જાય છે. બધાને સમયની વ્યસ્તતાને કારણે આવું થાય છે, બાકી જમાનાની તાસીર પ્રમાણે હવે મેળાવાનો સ્વરૂપ બદલાયો છે ને એની જગ્યા કિટી પાર્ટીઓએ લઈ લીધી છે. સારી વાત છે કે એ બહાને પણ આત્મીયતા જળવાઈ રહે છે પણ આજે વાત કરવી છે હાલમાં બહુજ ફેલાયેલા અસાધ્ય ગંભીર બીમારીઓની જેમાં કોઈ ઉમરનો બાધ નથી અને આવી માંદાઈ અણધારી આવી પડે છે ત્યારે ઘરના સભ્યો મુંઝાઈ જાય છે, કોની સલાહ લેવી ? કયા ડોક્ટરને અથવા કઈ હોસ્પિટલમાં બતાવવું ? ક્યાં એને યોગ્ય સારવાર મળશે ? વગેરે કોઈ જાણકારો સાથે વિચાર વિમર્શ કરી દર્દીની ટ્રીટમેન્ટ ચાલુ થાય છે. ધીમેધીમે સ્વજનોને કળ વળે છે ને પરિસ્થિતિ ને અપનાવે છે માનસિક રીતે હજુ તો સંતુલિત થાય છે ને હોસ્પિટલમાં દર્દીને મળવા માટે મુલાકાતીઓનો ઘસારો ચાલુ થઈ જાય છે. વિઝીટીંગ અવર્સમાં મેળો ભરાય છે. ક્યારે થયું ? ક્યારે ઘાબલ કર્યા ? ડોક્ટર કોણ છે ? હવે શું કહે છે ? ક્યારે ઓપરેશન થશે ? અમને તો આજે જ ખબર પડી વગેરે બધાને જવાબો આપીને સ્વજનો થાકી જાય છે. વળી દર્દી ICUમાં હોય તો પણ ગ્લાસ વીન્ડોમાં એની એક ઝલક જોવાની લાલચ ને રોકી નથી શકતા અને પછી અન્ય મુલાકાતીઓ સાથે ચર્ચાના ચગડોળે ચડેને બીમારીઓ વીશે પોતાની જાણકારીનો પ્રદર્શન કરે.

દર્દીને રજા મળે પછી થાય ઘેર મુલાકાતીઓનો મારો, વળી અહીં તો કોઈ સમયની પાખંધી નહીં પોતાની અનુકુળતા મુજબ સવાર, બપોર, રાત્રે જ્યારે ટાઈમ મળે ને ટપકી પડે, આવા સંજોગોમાં ઘરવાળાની હાલત કેટલી દયનીય હોય છે. એમને પણ શાંતિની, આરામની જરૂર હોય છે છતાં અમુક લોકો આવી ને દર્દીના સ્વજનોને વણમાંગી સલાહો આપતા રહે છે આ દવા લો ને પેલી ટેબ્લેટ તો આપતાજ નહીં, ખાવા પીવામાં પણ આ આપવું ને આ નહીં આપતાં, ફલાણા બહેનને આમજ હવું છતાં કહ્યું માન્યુ નહીં ને રોગ વધારે ફેલાઈ ગયો વળી કોઈ હકારાત્મક વાત તો કરે જ નહીં અહીં ત્યાંના મનઘડત કિસ્સા સંભળાવી દર્દી તથા તેમના સ્વજનો ને ડરાવી દે છે અને પોતે એ રોગ અનુભવી ચૂક્યા હોય તેમ એલોપેથીક, હોમીયોપેથીક, આયુર્વેદિક, ચૂનાની દવાઓની વાતો કરી ને ઉઠે, કંઈક નૈતીક ફરજ પૂરી કરી હોય તે રીતે દર્દીના ઘેરથી ગર્વથી બહાર નીકળે છે ને પંદર વીસ મીનીટમાં જ જે કોઈ રૂબરૂ મળે તેને અને ફોન દ્વારા દર્દીના સમાચારો પોતાનું થોડુ ઉમેરી ને બધા સુધી પહોચાડે છે. કેટલાંકની એવી આદત હોય કે આઠ દસ જણ ઉભા હોય ત્યાં આપીને બીજા સાંભળે એ રીતે દર્દીની બીમારીની વિશે જોર થી વાતો કરે ને અગર દર્દીનો કોઈ સગો અથવા પડોશી હોય તો પૂછે હવે એમને કેમ છે ? કંઈ સુધારો છે કે તબિયત વધારે લયડી છે! અરે ભલૂં થાય તમારું તમને આટલી ચિંતા છે તો એના આપ્તજનો નહીં હોય, શું એમને દર્દી ને સારાં કરવાની ખેવના નહીં હોય ? વળી લાગતાં વળગતા બેત્રણ જગાયે ફોન કરી ને માહિતીની સરખામણી કરે.

GREAT INVESTMENT OFFER

Govt. Approved

Villa Plots in Shadnagar Town

Opp. (NRSC)

Project is surrounded by
2000 Flats of gated community and Villas,
Very close to Highway
and Shadnagar Town

BANK LOANS AVAILABLE

Golden Galaxy

Sree Mahitha Group

For details call Srinivas

9885098503

११.५१.)

શા માટે ? આપણને અટલી બધી ખણખોદ કરવી જરૂર છે ?

હવે તો આપણે જમાના અનુસાર બદલાવવું પડશે, નવી પેઢીને આ બધું નથી ગમતું. આપણા આવા વ્યવહારથી દર્દીના સ્વજનોને સંકોચ થાય છે ને દુઃખ પણ લાગે છે. પડેલ આપત્તિ સામે સંઘર્ષ કરતાં હોય છે. ખરેખર એના માટે લાગણી હોય તો એકાંતમાં શાંતિથી બે વાતો કરી લેવી જોઈએ, એમની આર્થિક સ્થિતિ નબળી હોય તો આપણાથી બની શકે તો મદદ કરવીજ, અથવા ફોનમાં ટુંકાણમાં ખબર અંતર પૂછી લેવા, વળી રોજેરોજ રીપોર્ટ લેવાની જરૂર નથી. કોઈ ડોક્ટર અથવા દવાની પૂરી ખાત્રી પૂર્વક જાણકારી હોય તોજ સલાહ આપવી, વળી આપણાજ કોઈ સ્વજનને એના થકી ફાયદો થયો હોય તોજ એ વીશે જાણ કરવી પછી એમને વારે ઘડીયે ખતેલ નહીં પહોંચાડતા...

આ બધી બાબતો આપણને નાની લાગે છે. પણ ખરેખર તો આવી આપણા જેના પર આવે એનેજ એની પીડાની ખબર હોય, સમાજના આવા બદલાવથી કોઈને ખોટું નહીં લાગે, આપણે બધાજ સારા નરવા રહે તેવી આપણાં ઈષ્ટદેવને પ્રાર્થના કરતા રહેવું આખરે તો બધાની જીવાદોરી એના હાથ માં છે ને?

20 Days
Medicine
Only Rs. 350/-

AYURVEDIC (WEIGHT - LOSS) MEDICINE

Weight loss will be after 20 days 7 kg. West Material Discharge.

- AYURVEDIC (SUGAR) MEDICINE 30 DAYS ONLY RS. 350/-
- AYURVEDIC (THYROID) MEDICINE 20 DAYS ONLY RS. 350/-

Ph : 9395347264, 9392418463, 040-27564183

(શ.ખ.)

મુંબઈનું પ્રખ્યાત નમકીન, ચીક્કી, ખાખરા હવે હૈદરાબાદમાં


ખાખરા (KHA KHRA)

ચીક્કી (CHIKKI)

ચીવડા (CHI WDA)

સેવ/ગાઠીયા
(SEV/GATHIYA)

બટર ચકરી
(BUTTER CHAKRI)



તથા અન્ય ઘણી સ્વાદીષ્ટ વેરાચટી

હોમ મેડ ચોકોલેટ-HOME MADE CHOCOLATES, પાન મુખવાસમાં વેરાચટી - VARIETIES IN PAAN MUKHWAAS
WE TAKE ORDERS FOR : અમે કીટ્ટી, બર્થડે પાર્ટી, ગેટ-ટુ-ગેસ્ટ માટે ઓર્ડરથી બનાવી આપીશું.

પાવ ભાજુ-PAV BHAJI, બિર્યાની-BIRYANI, પુરણપોળી-PURAN POLI, સેન્ડવીચ ટોકલા-SANDWICH DHOKLA,
ટોકલા-DHOKLA, ખાંડવી-KHANDVI, ઉંઘીયાનું શાક તથા અન્ય શાકની વેરાચટી-TASTY CURRY'S

For Free Home Delivery or Shop at your home what's app or call : 09503565400 (Nitin K. Dand)

SAMRAT SWAAD

104, 1st Floor, Shyam Enclave, Opp. Canara Bank Badi Chowdi, Hyderabad. (T.S.)

(શ.ખ.)

છેલ્લા ૪૨ વર્ષથી આપની આંખોની સેવામાં
હૈદરાબાદ-સિકંદરાબાદના
અગ્રગણ્ય હોલસેલ અને રીટેલ ચશ્માના વેપારી

 **વોરા ઓપ્ટિક્સ** 

હૈદરાબાદ ઓપ્ટીશીયન

- ૧) આંખોના નીષ્ણાત ડોક્ટર/ઓપ્ટોમેટરીસ્ટ દ્વારા જાપાની કમ્પ્યુટર દ્વારા આપની આંખોની તપાસ.
 - ૨) લેટેસ્ટ ડીઝાઇનની સસ્તી, મીડીયમ, પ્રીમીયમ, બ્રાન્ડેડ ફ્રેમોની વિશાળ રેન્જ.
 - ૩) ઉચ્ચતમ ક્વોલીટીના પ્રોગ્રેસીવ, બાયફોકલ, ફોટો ગ્રે એન્ટીગ્લેર અને પોલારોઇડ ચશ્માના લેન્સીસની અદ્વિતીય શ્રેણી.
 - ૪) ડેલી પહેરવાના અને બ્રાન્ડેડ, ટડકાના ચશ્મા (સન ગ્લાસિસ), ડે એન્ડ નાઇટ ડ્રાઇવીંગના સન ગ્લાસેસની વિશાળ રેન્જ.
 - ૫) ગુજરાતી તમામ ભાઈઓ બહેનો માટે વિશેષ છુટ.
- દુનિયાની સર્વશ્રેષ્ઠ બાન્ડસના ઓથીરાઇડસ ઓપ્ટીશીયનસ, રેંધન, વોગ, ઓકલી, ટોમી હીલફીગર પોલીસ અરમાની, મોન્ટ પ્લેન્ક, સીલૌટી બોસ એન્ડ લોમ્બ.

VORA OPTICS
Wholesale Optical House

4-1-355, Shop Nos. 13C / 14C / 21C / 22C,
 Malti Naik Plaza,
 Hotel Jaya International Lane, Abids,
 Hyderabad -500 001.

Ph : 040-66888822 (3 lines) 66888833 (3 lines)

Vijay Vora - 98490 79797,
Rajveer Vora - 8019998877

HYDERABAD
OPTICIANS

G-26, Kubera Towers
 Near Narayanguda Fly Over,
 Himayatnagar, Hyderabad - 500 029

Vimal Vora - 98480 71069

(જા.ખ.)

ભગવાન શ્રી રામની વંશાવલિ...

૧. બ્રહ્માજીથી મરીચિ થયા
૨. મરીચિના પુત્ર કશ્યપ થયા
૩. કશ્યપના પુત્ર વિવસ્વાન થયા
૪. વિવસ્વાનના પુત્ર વૈવસ્વત મનુ થયા (વૈવસ્વત મનુ ના સમયમાં જલ પ્રલય થયો હતો.)
૫. વૈવસ્વત મનુના દસ પુત્રોમાં એક ઈક્ષવાકુ હતા. (ઈક્ષવાકુએ અયોધ્યાને રાજધાની બનાવી આમ ઈક્ષવાકુ કૂળની સ્થાપના થઈ)
૬. ઈક્ષવાકુના પુત્ર કૂક્ષિ થયા
૭. કૂક્ષિના પુત્ર વિકૂક્ષિ હતા.
૮. વિકૂક્ષિના પુત્ર બાણ થયા.
૯. બાણના પુત્ર અનરણ્ય થયા.
૧૦. અનરણ્યના પુત્ર પૃથુ થયા.
૧૧. પૃથુના પુત્ર ત્રિશંકુ
૧૨. ત્રિશંકુના પુત્ર ધુંધુમાર થયા
૧૩. ધુંધુમારના પુત્ર યુવનાશ્વ હતા
૧૪. યુવનાશ્વના પુત્ર માન્ધાતા થયા
૧૫. માન્ધાતાના પુત્ર સુસન્ધિ હતા
૧૬. સુસન્ધિના બે પુત્ર ધ્રુવસન્ધિ અને પ્રસન્નજિત
૧૭. ધ્રુવસન્ધિના પુત્ર ભરત થયા
૧૮. ભરતના પુત્ર અસિત
૧૯. અસિતના પુત્ર સગર
૨૦. સગરના પુત્રનું નામ અસમંજ હતું
૨૧. અસમંજ ના પુત્ર અંશુમાન થયા
૨૨. અંશુમાનના પુત્ર દિલીપ
૨૩. દિલીપના પુત્ર ભગીરથ હતા (ભગીરથે ગંગાને પૃથ્વી પર ઉતારી હતી)
૨૪. ભગીરથના પુત્ર કકુલ્થ હતા.
૨૫. કકુલ્થના પુત્ર રઘુ થયા (રઘુ અત્યંત તેજસ્વી અને પરાક્રમી નરેશ હોવાથી એમના વંશનું નામ રઘુવંશ થઈ ગયું. ત્યારથી ભગવાન શ્રીરામના કૂળનું નામ રઘુવંશ તરીકે ઓળખાય છે.)
૨૬. રઘુના પુત્ર પ્રવૃહ્દ હતા.
૨૭. પ્રવૃહ્દના પુત્ર શંખણ
૨૮. શંખણના પુત્ર સુદર્શન થયા

૨૯. સુદર્શનના પુત્રનું નામ અગ્નિવર્ણ હતું.
 ૩૦. અગ્નિવર્ણ ના પુત્ર શીઘ્ર
 ૩૧. શીઘ્રના પુત્ર મરૂ હતા.
 ૩૨. મરૂના પુત્ર પ્રશુશ્રુક થયા
 ૩૩. પ્રશુશ્રુકના પુત્ર અંબરીશ
 ૩૪. અંબરીશના પુત્ર નહુષ
 ૩૫. નહુષના પુત્ર યયાતિ
 ૩૬. યયાતિના પુત્ર નાભાગ થયા
 ૩૭. નાભાગના પુત્ર અજ હતા.
 ૩૮. અજના પુત્ર દશરથ થયા.
 ૩૯. દશરથના ચાર પુત્ર રામ, ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન હતા.
- આ પ્રમાણે બ્રહ્માજીની ઓગણચાલીસમી પેઢીમાં ભગવાન શ્રીરામનો જન્મ થયો.

— એક સંશોધિત માહિતિના આધારે
દિનેશ ગોસર

સમાજ ગૌરવ



શ્રી.કુ. નીતિ વિપુલ

હરિલાલ નીસર, ગામ વડાલા

C.A. Final પ્રથમ પ્રાયસે ઉત્તિર્ણ થયેલ છે.

હાર્દિક અભિનંદન.

નોંધ : ગત અંકમાં “સમાજ ગૌરવ” કોલમમાં નીચે મુજબ નામ સુધારી વાંચવા વિનંતી.

KHUSH KAILASH CHEDDA



ITS A QUIZ TIME

..?! ..?! ..?! ..?!

Ramesh M. Shah
M : 94409 96652

Given below are the Photographs of famous Indian Personalities in various fields. You have to Identify them and give their names below the Photograph. You can take a snap of the page and send it on the above mentioned mobile number by whatsapp.

ALTERNATIVELY, you can give serial number of the Photo and give the name of the person by SMS or whatsapp or in writing to KMM Office on or before end of February 2017.





1.....

2.....

3.....

4.....

5.....



6.....

7.....

8.....

9.....

10.....




11.....

12.....

13.....

14.....



15.....

16.....

17.....


18.....

The correct answers to the last months Quiz are :

1. AYODHYA - SARYU
2. ALLAHABAD - GANGA
3. KOLKATTA - HOOGHLI
4. CHENNAI - ADYAR-COOUUM
5. VODODARA - VISWAMITRI
6. CAIRO - NICE
7. KARACHI - INDUS
8. LONDON - THAMES
9. NEWYORK - HUDSON
10. PARIS - SIENE
11. YONGOON - RANGOON - IRRAWADY
12. DELHI - YAMUNA
13. RAJAHMUNDRY - GODAVARI
14. BAGHDAD - TIGRIS
15. AHMEDABAD - SABARMATI
16. HYDERABAD - MUSI
17. BONN - RHINE
18. LAHORE - RAVI
19. ROME - TIBER
20. VIJAYAWADA - KRISHNA

Persons who have given correct Answers to last month's quiz

- AKSHIT BHAVESH GALA
 BHAVIN NARENDRA GALA
 BHAVIKA VORA
 DHAVAL SAILESH SHAH
 DHRUPTI HIMESHKUMAR DODHIA
 HASMUKH MALSI MARU
 HEENA VIJAY DEDHIA
 JIGNA MAMANIYA
 JYOTI L. NAGDA
 KHIRESH NAVEEN NAGDA
 KHYATI H. SHAH
 KALPANA MEHTA
 KHUSH KAILASH CHEDDA
 NAMAN KAILASH CHEDDA
 NISHA SAILESH MEISHERI
 NEEV MEHUL FURIA
 RUPAL HARESH SAVLA
 RAHUL D. SHAH
 SONAL PIYUSH GOSAR
 SIDDHANT MOMAYA
 TRUSHALI SANJAY LALKA
 VINAY DAND
 VANSH GOSAR



FOR SALE

**1800 SQ. FEET BUILT UP AREA, SEMI-FURNISHED FLAT,
 VERY GOOD CONDITION, 3 BEDROOM
 on 4th Floor, Road facing, Subhodaya Apartments,
 Beside Fernandez Hospital, Boggulkunta, Abids, Hyderabad.
 Contact : Meeraj Shah, 9885800002
 email : neeraj@shahsonline.com**

(९१.५६.)

શુભ

॥ અનંત ચૌવિંશી જીન નમો ॥

લાભ



શ્રી કુલપાકજી તીર્થ યાત્રી સંઘ (Regd.)

(માતૃશ્રી વિમળાબેન મગનલાલ ભેદા પરિવાર)



૩-૪-૨૧૫/અ, આર.કે. કૉમ્પ્લેક્સ, બેન્ક ઓફ ઈન્ડિયાની ઉપર,

કાચીગુડા, હૈદરાબાદ ૫૦૦ ૦૨૭. ફોન : ૦૪૦-૬૬૩૬ ૨૫૪૫, ૨૭૫૬ ૨૫૪૫

સંચાલક : હંસકુમાર રાયચંદ સાયલા ફોન. ૯૨૪૬૫૩૨૫૪૫, પ્રચાર સંયોજક : સિદ્ધીશ રમેશ જાગીરદાર

દર મહિનાના પહેલા રવિવારે કાચીગુડાથી શ્રી કુલપાકજી તીર્થ યાત્રા માટે એક બસની વ્યવસ્થા છે. તથા સાથે-સાથે ત્રીજા રવિવારે શ્રી મેડચલ તીર્થ યાત્રા માટે એક બસની વ્યવસ્થા છે. નકરો રૂ.૫૦/- વ્યક્તિ દીઠ તથા બસના લાભાર્થીનો રૂ.૫૧૦૦/- નકરો છે.

સમસ્ત જૈન સમાજમાં માન્યતા પામેલ આવા સુંદર આયોજનનું જરૂરથી લાભ લેશો તથા અન્યને પણ લાભ લેવા પ્રેરીત કરશો.

જૈન સ્તવન હરીફાઈ

રવિવાર તા. ૯ એપ્રિલ ૨૦૧૭ના સાંજના ઠીક ૭.૦૦ વાગ્યાથી શ્રી જીનેશ્વરધામ મંદીરના પ્રાંગણમાં શ્રી અચલગચ્છ જૈન સંઘ હૈદરાબાદ સીટીના સહયોગથી જૈન સ્તવનોની હરીફાઈ રાખવામાં આવેલ છે. ત્રયનગરના સમસ્ત ભાવિકોને ભાગ લેવા ભાવભર્યું આમંત્રણ છે.

હરીફાઈ ચાર ગ્રુપમાં રહેશે. ૫ વર્ષ થી ૧૫ વર્ષ સુધીની એક, ૧૫ વર્ષથી ૩૫ વર્ષ સુધીનો બીજો, ૩૫ વર્ષથી ૫૦ વર્ષ સુધીનો ત્રીજો તથા ૫૦ વર્ષથી ઉપરનો ચોથો ગ્રુપ બનાવવામાં આવશે. પ્રત્યેક ગ્રુપને પહેલો, બીજો તથા ત્રીજો ઈનામ આપવામાં આવશે. ભાગલેનાર પ્રત્યેક સ્પર્ધકને પ્રોત્સાહનાત્મક ઈનામ આપવામાં આવશે. તારીખ ૩૧ માર્ચ ૨૦૧૭ સુધી પોતાના નામો સંચાલકશ્રીને લખાવવા વિનંતી. નામ, ઉંમર, ફોન નંબર તથા ક્યો સ્તવન રજુ કરવાના છે તેની પહેલી લાઈન આપવી પડશે.

પૂના, કાતરજ, આદી પંચ તીર્થો સાથે મહા બલેશ્વરની યાત્રા

૨૩ જુન ૨૦૧૭ના હૈદરાબાદથી પ્રસ્થાન કરી તા. ૨૯ જુન ૨૦૧૭ સુધી યાત્રાપૂર્ણ કરી પાછા ફરશું. નકરો રૂ. ૫૦૦૦/- રાખવામાં આવેલ છે. તારીખ ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૭ સુધી નામો રૂ.૧૦૦૦/- (Non refundable) રકમ સાથે સંચાલકશ્રીને લખાવવા વિનંતી. બાકીના પૈસા ટ્રેનમાં બેઠા પછી આપવાના રહેશે. પાછા ફરતી વખતે વધ ઘટનો હિસાબ આપવામાં આવશે.

આજીવન સભ્યપદ સંકલ્પ અનુદાન પત્ર આવા એક અને અનેક યોજનાનું લાભ લઈ પુન્યાર્જન કરશોજી.

શ્રી કુલપાકજી તીર્થ યાત્રાના કાયમી સંઘપતિ તથા વિજ્ઞાપન સૌજન્ય :
માતૃશ્રી દેવયાનીબેન કલ્યાણજી રામજી રવજી સોજપાલ ગાલા પરિવાર,
 ગામ મોટા લાયજા-કચ્છ, હાલ સાયન-મુંબઈ
 હસ્તે શ્રીમતી મમતાબેન (વારાબેન) ભુપેન્દ્ર કલ્યાણજી ગાલા મુમુક્ષુ પરિવારના જયજિનેન્દ્ર

(જા.મ.)